

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, ગાંધીનગર

પ્રેસ નોટ

તા.:૩૧/૦૩/૨૦૨૦

રાજ્ય સરકાર હસ્તકની વિજ વિતરણ/ઉત્પાદન અને વિજ પ્રવહન કંપનીઓ તથા અન્ય વિજ વિતરણ કંપનીઓ દ્વારા જીઇઆરસી (બહુવર્ષિય પ્રશુલ્ક) વિનિયમો-૨૦૧૬ અનુસંધાને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯નું ટુ-અપ અને નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નાં પ્રશુલ્ક નિર્ધારણ માટે પીટીશનો દાખલ કરેલ. સદર પીટીશનો જીઇઆરસી (બહુવર્ષિય પ્રશુલ્ક) વિનિયમો-૨૦૧૬ અનુસંધાને વાર્ષિક હિસાબો સાથે દાખેલ કરેલ. આ પીટીશનો ઇલેક્ટ્રીસીટી એક્ટ, ૨૦૦૩ અને સંલગ્ન વિનિયમો અનુસંધાને રજીસ્ટર કરી પ્રશુલ્ક આદેશ આપવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ.

આ પરવાનેદારોને આ અરજીઓ જાહેર જનતાની ભાગીદારીની ખાતરી કરવા જાહેરમાં પ્રકાશિત કરવા નિર્દેશ આપવામાં આવેલ. સામાન્ય જનતા અને હિતધારકો પાસેથી વાંધાઓ/સુચનો મંગાવવાની વિસ્તૃત કાર્યવાહી કરવામાં આવેલ. આ વાંધાઓ સુચનોની ચકાસણી કરીને ૧૧ અને ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ નાં રોજ આયોગની કચેરી ગાંધીનગર ખાતે, ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ ભરૂચ ખાતે તેમજ ૧૮, ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ રાજકોટ ખાતે જાહેર સુનાવણી આયોગ દ્વારા કરવામાં આવેલ. આ સુનાવણીમાં કેટલાક હિત ધરાવનારાઓએ, વ્યક્તિગત અને સંગઠનો સહિત આ સુનાવણીમાં ભાગ લીધો હતો.

આયોગ દ્વારા આ પીટીશનો પર આદેશો આપવામાં આવેલ છે. આ આદેશો ના મહત્વનાં/અગત્યનાં મુદ્દાઓ નીચે મુજબ છે:

રાજ્ય સરકાર હસ્તકની વિજ વિતરણ તેમજ ટોરન્ટ પાવર લીમીટેડ અમદાવાદ-ગાંધીનગર અને સુરત વિસ્તારના ગ્રાહકો માટેના વિજ દરમાં કોઈ વધારો નથી.

- બીપીએલ ગ્રાહકો માટે ૩૦ યુનિટ દીઠ પ્રતિ માસ ને બદલે ૫૦ યુનિટ દીઠ પ્રતિ માસ ના વિજ વપરાશ માટે હવેથી રૂ ૧.૫૦ પ્રતિ યુનિટ ના રાહતદરે લાગુ પડશે.. આ ફેરફાર સાથે બીપીએલ ગ્રાહક માટે દર મહિને ૫૦ યુનિટનો વીજ વપરાશ કરનારને વીજળી બિલ માં ૩૦ ટકાથી વધુનો ઘટાડો થશે.
- લિફ્ટ સિંચાઈના હેતુ માટે વીજળીનો ઉપયોગ કરતા કૃષિ ગ્રાહકો માટે એનર્જી ચાર્જ રૂ. ૧.૫૦ પ્રતિ યુનિટ થી ઘટાડી ને રૂ. ૦.૮૦ પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે, આ ફેરફાર સાથે, આ કેટેગરીના ગ્રાહકોના વીજ બિલમાં ૪૩% કરતા વધુ ઘટાડો થશે.

- વધુ ઉચ્ચ વોલ્ટેજ (ઇએચવી) પર સપ્લાય લેતા ગ્રાહકોને હવે થી ઇએચવી પર વધુ રિબેટ મળશે કારણ કે ૩૩ કેવી/૬૬ કેવી નો સપ્લાય મેળવતા ગ્રાહકો માટે ઇએચવી રિબેટ સુધારીને ૦.૫% થી ૦.૭૫ % થશે અને ૧૩૨ કેવી અને તેથી વધુના સપ્લાય મેળવતા ગ્રાહકો માટે ઇએચવી રિબેટ ૧.૦૦% થી સુધારીને ૧.૨૫ % થશે
- રાજ્ય સરકાર હસ્તકની વિજ વિતરણ કંપની ના એચ.ટી. ગ્રાહકો માટે રાત્રિ સમયના વિજ વપરાશ માટેનો રિબેટ યુનિટ દીઠ ૪૦ પૈસાથી વધીને ૪૩ પૈસા પ્રતિ યુનિટ કરવામાં આવેલ છે.
- રાજ્ય સરકાર હસ્તકની વિજ વિતરણ કંપની માટે, સ્ટ્રીટ લાઇટ ટેરિફ કેટેગરી હવે 'જીએલપી' કેટેગરીમાં મર્જ કરવામાં આવી છે.
- વેજિટેબલ ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝને મોસમી/સિઝનલ ગ્રાહક લાભો પસંદ કરવાની મંજૂરી આપેલ છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં યુજીવીસીએલ અને પીજીવીસીએલ સિવાય - રાજ્યની વિતરણ કંપનીઓએ આયોગ દ્વારા નિર્ધારિત કરેલ વિજ વિતરણ ઘટ ઘટાડવાના લક્ષ્યને ઓળંગી વિતરણ ઘટમાં નોંધપાત્ર સુધારો પ્રાપ્ત કર્યો. આયોગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટેના આપવામાં આવેલા લક્ષ્ય અને સામે પ્રાપ્ત કરેલ વાસ્તવિક વિજ વિતરણ ઘટ નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે:

વર્ષ ૨૦૧૮-૧૯ ના વિજ વિતરણ ઘટ

ડિસ્કોમ	આયોગ દ્વારા મંજૂર કરાયેલ લક્ષ્ય	ડિસ્કોમ દ્વારા પ્રાપ્ત થયેલ
દક્ષિણ ગુજરાત વિજ કંપની	૧૦.૦૦%	૫.૯૦%
મધ્ય ગુજરાત વિજ કંપની	૧૧.૬૫%	૯.૯૮%
પશ્ચિમ ગુજરાત વિજ કંપની	૨૦.૦૦%	૨૦.૫૦%
ઉત્તર ગુજરાત વિજ કંપની	૯.૮૦%	૧૧.૯૦%
ટીપીએલ - અમદાવાદ	૬.૮૫%	૫.૬૧%
ટીપીએલ - સુરત	૩.૬૯%	૩.૪૩%

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે, માન્ય વીજ ખરીદીનો ખર્ચ રૂ.૪.૩૨ પ્રતિ યુનિટ હતો અને રાજ્ય સરકાર હસ્તકની વિજ વિતરણ પરવાનેદાર કંપનીઓ (યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને પીજીવીસીએલ) માટે બેઝ એફપીપીપીએ ચાર્જ યુનિટ દીઠ રૂ ૧.૬૧ હતો વીજ ખરીદી ખર્ચમાં રૂ ૪.૩૨ થી ઉપર કોઈપણ વધારો વધારાના એફપીપીપીએ ચાર્જ તરીકે ગણવામાં આવશે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે, આયોગે વીજ ખરીદી ખર્ચને રૂ.૪.૩૦ પ્રતિ યુનિટ

માન્ય રાખેલ છે અને આ અનુસાર બેઝ એફપીપીપીએ સુધારીને રૂ.૧.૫૯ કરવામાં આવેલ છે.
(૪.૩૦ બાદ ૪.૩૨ = -૦.૦૨ + ટી એન્ડ ડી લોસિસ = ૦.૦૨ માંથી બાદબાકી ૧.૬૧ = ૧.૫૯).

ટોરેન્ટ પાવર લિમિટેડ હાલમાં ફૂલ એફપીપીપીએ ચાર્જની રૂ.૨.૧૧ યુનિટ દીઠ વસૂલાત કરે છે આયોગે ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા એફપીપીપીએ ચાર્જની વસૂલાત માટે રૂ. ૨.૧૧ પ્રતિ યુનિટની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. ઉપરાંત, ટીપીએલ-ડી (અમદાવાદ અને ગાંધીનગર વિસ્તાર) માટે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ની અંદાજિત આવકની ગણતરી માટે, બેઝ એફપીપીપીએ રૂ.૧.૮૨ પ્રતિ યુનિટ માન્ય રાખવામાં આવેલ છે.

Sd/-
(રૂપવંત સિંહ આઇએએસ)
સચિવ
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ,
ગાંધીનગર